

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટન આઉટડોર ટેનિસ કોર્ટ્સ, પિકલબૉલ કોર્ટ્સ અને પીલ વિલેજ ગોલ્ફ કોર્સને મે 19 અને 22 થી ફરીથી ખોલશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (મે 15, 2020) – ઓન્ટેરિયો સરકારની કેટલીક મનોરંજનલક્ષી સગવડો ફરીથી ખોલી શકાતી હોવાની ઘોષણા થયા પછી, સીટી ઓફ બ્રેમ્પટન મંગળવાર, મે 19 થી પોતાની આઉટડોર ટેનિસ કોર્ટ્સ અને પિકલબૉલ કોર્ટ્સ, અને શુક્રવાર, મે 22 થી પીલ વિલેજ ગોલ્ફ કોર્સ ફરીથી ખોલશે. તમામ મુલાકાતીઓ અને સીટી કર્મચારીઓનું આરોગ્ય અને સુરક્ષાની ખાતરી કરાવવા વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવાના અને સ્વચ્છતા સંબંધિત પગલાઓ લેવામાં આવશે.

આઉટડોર ટેનિસ કોર્ટ્સ અને પિકલબૉલ કોર્ટ્સ

આપણું શહેર પોતાની 21 ટેનિસ કોર્ટ્સ અને સાત પિકલબૉલ કોર્ટ્સ મંગળવાર, મે 19 નાં રોજ ફરીથી ખોલશે. આ કોર્ટ્સ સોમવારથી રવિવાર સુધી ખુલ્લી રહેશે. સવારે 11 વાગ્યા પહેલાં, કોર્ટ્સ સંપૂર્ણપણે માત્ર વડીલો માટે ઉપલબ્ધ રહેશે.

વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવાના પગલાઓ સાથે સુસંગત રહીને, એક સમયે બેથી વધારે ખેલાડીઓને કોર્ટ પર પરવાનગી આપવામાં આવશે નહિ, એટલે કે નેટ (જાળીની) દરેક બાજુએ એક ખેલાડી જ રહેશે. ખેલાડીઓએ બધાં સમયે એકબીજાથી ઓછામાં ઓછું બે મીટર (છ ફૂટ) દૂર અચૂક રહેવું પડશે. વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર ન જાળવતા લોકોને જતા રહેવાનું કહેવામાં આવશે.

દરેક વ્યક્તિનું આરોગ્ય અને સુરક્ષાની ખાતરી કરવા, નીચેના નિયમો અમલમાં છે:

- કોર્ટ્સ વહેલો તે પહેલો ધોરણે ઉપલબ્ધ રહેશે, અને અન્ય લોકો રાહ જોતા હોય ત્યારે સ્મવા માટે 60 મિનિટ જ સીમિત રહેશે
- એકબીજા સાથે રેક્ટસ કે અન્ય સાધનોની આપલે કરશો નહીં
- બોલ્સ સ્પષ્ટપણે ચિહ્નિત હોવા જોઈએ જેથી અન્ય લોકો દ્વારા ભૂલથી પણ તેને લેવાનું કે ઉઠાવવાનું ટાળી શકાય
- આઉટડોર રેસ્ટરૂમ્સ (સગવડો હોય ત્યાં) આ સમયે ઉપલબ્ધ નથી
- કોઈ દર્શકને આવવાની છૂટ નથી

ટેનિસ કોર્ટ કે પિકલબૉલ કોર્ટ શોધવા વેબસાઈટ જુઓ, www.brampton.ca/parks. કોઈ વિવાદાસ્પદ બાબત જણાવવા, 311 નંબર પર કૉલ કરો.

પીલ વિલેજ ગોલ્ફ કોર્સ

સીટી ઓફ બ્રેમ્પટન દ્વારા પીલ વિલેજ ગોલ્ફ કોર્સ શુક્રવાર, મે 22 થી ફરીથી ખોલવામાં આવશે જે અહીં સ્થિત છે: 29A Hartford Trail. આ ગોલ્ફ કોર્સ દરરોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, અલબત્ત હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને. વડીલો માટેનો સમય સવારે 7 થી 11 વાગ્યા સુધીનો છે.

વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવાના પગલાઓ સાથે સુસંગત રહીને, ખેલાડીઓએ બધાં સમયે એકબીજાથી ઓછામાં ઓછું બે મીટર (છ ફૂટ) દૂર અચૂક રહેવું પડશે. વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર ન જાળવતા લોકોને જતા રહેવાનું કહેવામાં આવશે.

ગોલ્ફ કોર્સમાં દરેક વ્યક્તિનું આરોગ્ય અને સુરક્ષાની ખાતરી કરવા, સીટી વધારાની સાવચેતીઓ લેવાનું કહી રહ્યું છે, જેમાં સામેલ છે:

- સમગ્ર ગોલ્ફ કોર્સમાં હાથ ધોવા માટે હેન્ડવૉશિંગ સ્ટેશન્સ અને હેન્ડ સેનિટાઈઝર પૂરા પાડવા

- ગોલ્ડ ખેલાડીઓ માટે ડેક્લ્સ (ગોલ્ડ કોર્સની સપાટી પર બેસાડાતું લેબલ અથવા ચિત્ર કે ડિઝાઇન) અને દિશાસૂચક ચિહ્નો બેસાડવામાં આવશે જેથી પાર્કિંગ સ્થળ અને ક્લબ હાઉસ આસપાસ સુરક્ષિત હેરફેરની ખાતરી કરી શકાય
- દરેક ટી ટાઇમ દીઠ બે ખેલાડીઓ અને ગોલ્ડ કાર્ટ દીઠ એક ખેલાડી સીમિત રહેશે
- ટી ઓફ ટાઇમ વચ્ચેનો વિરામ વધારીને 20 મિનિટનો કરવામાં આવશે
- ગોલ્ડ કાર્ટ્સ અને બાયરૂમ્સ માટે ચેપનાશક કાર્યક્રમ સહિત, સગવડોની વધારે સારી અને અવારનવાર સફાઈનો અમલી બનશે
- બંકર રેક્સ કાઢીને ગોલ્ડ કમ્પ્સની ઊંચાઈ વધારીને “સ્પર્શરહિત રમત”ની ખાતરી કરવામાં આવશે
- સીટીના શારીરિક અંતર જાળવવાના પ્રયત્નોનું ઉલ્લંઘન ટાળવા ગોલ્ડ કોર્સ પર વધારાના સુરક્ષા પગલાઓ શરૂ કરવામાં આવશે.

આ સમયે, ગોલ્ડ કોર્સ દ્વારા ગ્રૂપ રિઝર્વેશન્સ, ટુર્નામેન્ટ્સનું આયોજન કરવામાં આવશે નહિ, કે સૂચનાલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે નહીં.

રહેવાસીઓને ટી ટાઇમ અગાઉથી બૂક કરવા 905.874.2995 નંબર પર કોલ કરવાનું કહેવામાં આવે છે, અને ચૂકવણીઓ આગમન સમયે સ્થળ પર કરી શકાય છે. ફોન લાઈન્સ મંગળવાર, મે 19 નાં રોજ બપોરે 1 વાગ્યાથી ચાલુ થશે. વોક-ઇન (ગમે ત્યારે ચાલ્યા આવવાની) સર્વિસ પૂરી પાડવામાં આવશે નહીં. પેટ્રન સભ્યોને પોતાના નિર્ધારિત ટી ટાઇમથી 15 મિનિટથી વધારે વહેલાં ન આવવાનું અને ક્લબહાઉસમાં સીધેસીધાં રિસોપ્શન વિસ્તારમાં જવાનું કહેવામાં આવે છે. પ્રતિબંધો અમલમાં છે ત્યારે ઘટાડેલો દર ઉપલબ્ધ થશે. ગોલ્ડ કોર્સમાં ટ્રેસ કોડ (પહેરવેશ નિયમો) અમલમાં રહે છે.

ક્લબહાઉસ અને પ્રો-શોપ બંધ રહેશે, અને પુલ કાર્ટ અને ક્લબ રેન્ટલ્સ આગળ સૂચના આપવામાં આવે નહિ ત્યાં સુધી હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવશે. આઉટડોર રેસ્ટરૂમ્સ પેટ્રન સભ્યો માટે રમત પહેલાં અને પછી ઉપલબ્ધ છે. ખાદ્ય પદાર્થો અને પીણાં આ સમયે ખરીદવા માટે ઉપલબ્ધ થશે નહિ, અને પેટ્રન સભ્યો પોતાની જાતે પાણી અને આલ્કોહોલ-રહિત પીણાં લાવી શકે છે.

પીલ વિલેજ ગોલ્ડ કોર્સ નવ કાણાંવાળો પબ્લિક ગોલ્ડ કોર્સ છે જે સીટી ઓફ બ્રેમ્પટનની માલિકીનો અને તેઓ દ્વારા સંચાલિત છે. COVID-19 ને લગતા પગલાઓ અને વિચારણાઓ પર સંપૂર્ણ વિગતો સહિત, રમતનું બૂકિંગ કરવા સંબંધિત સંપૂર્ણ માર્ગદર્શિકા વેબસાઈટ પર ઓનલાઈન ઉપલબ્ધ છે, www.brampton.ca/peelvillagegolf.

સીટી રિઓપનીંગ (ધંધાઓ ફરી ખોલવા) અને રિક્વરી માટેની વધુ યોજનાઓ પર સમુદાયનો પ્રતિસાદ માગે છે

મેયરના રિઓપનીંગ એન્ડ રિક્વરી વર્કિંગ ગ્રૂપે શહેરમાં ધંધાઓનું રિઓપનીંગ જાહેર જનતા અને કર્મચારીઓની સેવા અને સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળતું હોવાની ખાતરી કરાવવા સમુદાયને વચનબદ્ધ થવાનો અભિગમ અપનાવવાની શરૂઆત કરી છે. આમાં ચોક્કસ વપરાશકાર સમૂહો, ધંધાઓ અને સામુદાયિક સમૂહો સાથે શ્રેણીબદ્ધ સલાહ-મસલતો કરવાનો સમાવેશ થાય છે. સીટીએ આ અઠવાડિયે સ્પોર્ટ્સ ગ્રૂપ્સ સાથે બેઠક યોજી હતી અને આવતા અઠવાડિયે તેઓ વડીલોના સમૂહો સાથે સલાહ-મસલત કરશે. બ્રેમ્પટન સમુદાયને એક સર્વે જે [અહીં ઓનલાઈન ઉપલબ્ધ છે](http://www.brampton.ca/covid19reopency) તેમાં સહભાગી થઈને, અથવા covid19reopency@brampton.ca ને ઈમેઇલ મોકલીને પોતાનો પ્રતિસાદ જણાવવા પણ આમંત્રિત કરવામાં આવ્યું છે.

COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં સીટી તરફથી વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, www.brampton.ca/COVID19.

અવતરણો (ક્વોટ્સ):

“સીટી ઓફ બ્રેમ્પટન આપણાં સીટી ગોલ્ડ કોર્સ સહિત વધારાની સેવાઓ ઉપલબ્ધ કરાવે છે, અમે આ કાળજીપૂર્વક કરી રહ્યાં છીએ જે વપરાશકર્તાની સુરક્ષાને પ્રથમ અને મોખરે રાખે છે. એક આરોગ્યપ્રદ અને સુરક્ષિત શહેર તરીકે, અમે રહેવાસીઓને સક્રિય જીવનશૈલી જાળવવા જોવા રોમાંચિત થયા છીએ, અને રહેવાસીઓ નિર્ભર હોય તેવી આ સેવાઓને સુરક્ષિત રીતે ફરીથી ખોલવા અમે જરૂરી પગલાઓ લઈ રહ્યાં છીએ.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“આ અઠવાડિયે સીટીના રિઓપનિંગ અને રિકવરી વર્કિંગ ગ્રૂપને સીધું શહેરના સ્પોર્ટ્સ ગ્રૂપ્સ પાસેથી સાંભળવા મળ્યું અને શહેરની કોર્ટ્સ અને ગોલ્ફ કોર્સને ફરીથી ખોલવા સુરક્ષિત અભિગમ વડે તે માહિતીને પ્રતિક્રિયા કરવામાં અમને ખુશી થાય છે. આપણે આમાં એકસાથે છીએ અને શહેરની સર્વિસીસ ફરી શરૂ કરીએ અને આપણાં શહેરને ફરી કાર્યરત કરીએ ત્યારે અમે પીલ પબ્લિક હેલ્થની સલાહ અનુસરવાનું ચાલુ રાખીશું.

- *માર્ટિન મેડેઇરોસ (Martin Medeiros), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; લીડ, રિઓપનીંગ એન્ડ રિકવરી વર્કિંગ ગ્રૂપ*

“સીટી ઓફ બ્રમ્પટન અને અમારા કર્મચારીઓ માટે શહેરની સેવાઓ અને સગવડોની સુરક્ષા ટોચની અગ્રતા ધરાવે છે. અમે શહેરની સેવાઓ જવાબદારીપૂર્વક અને સુરક્ષિત રીતે ફરીથી ખોલીએ છીએ તેવી ખાતરી કરાવવા અમે જરૂરી પગલાઓ લેવાનું ચાલુ રાખીશું.”

- *ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રમ્પટન*

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca